

GUJARAT TECHNOLOGICAL UNIVERSITY
Diploma Semester -III Regular / Remedial Examination December - 2010

Subject code: 332102
Subject Name: Physical Metallurgy-I

Date: 27 /12 /2010**Time:** 10.30 am – 01.00 pm**Total Marks: 70****Instructions:**

1. Attempt all questions.
2. Make suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. English version is Authentic

| | | |
|-----------------|--|-----------|
| Q.1 | (a) What are the differences between Metal & Nonmetal. | 07 |
| | (b) Explain physical properties in detail. | 07 |
| Q.2 | (a) Explain the effect of grain boundry & grain size on the properties of metal. | 07 |
| | (b) Explain FCC with crystal structure diagram. | 07 |
| | OR | |
| | (b) Explain HCP with crystal structure diagram | 07 |
| Q.3 | (a) What are the effects of different cooling rates on grain size.Explain with suitable diagram. | 07 |
| | (b) Write the differences between micro examination and macro examination. | 07 |
| | OR | |
| Q.3 | (a) Explain Iron-Carbon equilebrium diagram. | 07 |
| | (b) Explain T.T.T.curve. | 07 |
| Q.4 | (a) Write the differences between Annealing process & Normalising process. | 07 |
| | (b) Define cold working.What are the advantages and Disadvantages of cold working process. | 07 |
| | OR | |
| Q. 4 | (a) What are the steps for preparing a microspecimen. | 07 |
| | (b) What is Etching reajent? Write the appropriate name of etching reajent composition for different specimen metals (any five). | 07 |
| Q.5 | (a) Explain solid solution. Write name of different examples of solid solution (any five). | 07 |
| | (b) Define following (1)Elasticity(2)Plasticity(3)Elasticlimit(4)hardness. | 07 |
| | OR | |
| Q.5 | (a) Explan Lever rule with appropriate diagram. | 07 |
| | (b) Define following(1)Ductility(2)Malleability(3)Creep(4)Hot hardness | 07 |
| પ્રશ્ન-૧ | અ ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત જણાવો. | 07 |
| | બ લોતિક ગુણધર્મો વિસ્તારથી સમજાવો. | 07 |

| | | |
|----------|---|----|
| પ્રશ્ન-૨ | અ ગ્રેઇન બાઉંડી અને ગ્રેઇન સાઇજની ધાતુના ગુણધર્મો પર થતી અસરો સમજાવો. | 07 |
| | બ ઇહ સ્ફિટિક સ્ટ્રેક્ચર આફુતિ સાથે સમજાવો. અથવા | 07 |
| | જહ. સ્ફિટિક સ્ટ્રેક્ચર આફુતિ સાથે સમજાવો | 07 |
| પ્રશ્ન-૩ | | |
| | અ જુદાજુદા કુલીંગ રેટની ગ્રેઇન સાઇજ પર થતી અસરો યોગ્ય આફુતિ સાથે સમજાવો. | 07 |
| | બ માઇક્રોટપાસણી અને મેક્રોટપાસણી વચ્ચેનો તફાવત લખો. અથવા | 07 |
| પ્રશ્ન-૩ | | |
| | અ આયર્ન કાર્બન સમતુલન આલેખ સમજાવો. | 07 |
| | બ T.T.T. કર્વ સમજાવો. | 07 |
| પ્રશ્ન-૪ | | |
| | અ એનીલીંગ પ્રક્રિયા અને નોર્મેલાઇઝીંગ પ્રક્રિયા વચ્ચેનો તફાવત લખો. | 07 |
| | બ કોલ વર્કીંગ પ્રક્રિયાની વ્યાખ્યા આપો. કોલ વર્કીંગ પ્રક્રિયાના ફાયદા તથા ગેરફાયદા જણાવો. | 07 |
| | અથવા | |
| પ્રશ્ન-૪ | | |
| | અ માઇક્રોસ્પેસીમેન તૈયાર કરવા માટેના કમબધ્ય પદો લખો. | 07 |
| | બ એચીગ રીએજંટ એટલે શુ ? એચીગ રીએજંટના યોગ્ય નામ જુદીજુદી સ્પેસીમેન ધાતુ માટે લખો.(કોઇપણ પાંચ) | 07 |
| પ્રશ્ન-૫ | | |
| | અ સોલીડ સોલ્યુશન સમજાવો. સોલીડ સોલ્યુશનના ઉદાહરણના નામ લખો. .(કોઇપણ ચાર) | 07 |
| | બ વ્યાખ્યાઆપો(૧) સ્થિતિસ્થાપકતા(૨)સુધટયતા(૩) સ્થિતિસ્થાપક હણ (૪)સખ્તાઈ. | 07 |
| | અથવા | |
| પ્રશ્ન-૫ | | |
| | અ લીવરનો નિયમ યોગ્ય આફુતિ સાથે સમજાવો. | 07 |
| | બ વ્યાખ્યાઆપો (૧) તન્યતા (૨) મુદુતા (૩) સરકણ (૪) હોટ હાર્ડનેસ. | 07 |
